

મને ખ્યાલ ન હતો કે બાબા તમે આટલા બધા સારા હશો.

બ્રહ્માકુમાર પ્રફુલ્લચંદ્ર શાહ; (M) 91-9825892710

ભકિત માર્ગમાં હતો ત્યારે માનતો હતો કે પરમાત્મા સર્વજ્ઞ છે; જ્ઞાનસાગર છે; જાની જાનનહાર છે; તેનાથી કશું જ અજ્ઞાત નથી. પરંતુ તે શું જાણે છે ? કોના વિશે જાણે છે? શાના વિષે જાણે છે? કેવું જાણે છે? કેટલું જાણે છે? તેનો કશોજ ખ્યાલ ન હતો. એક પ્રકારે અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાયેલો હતો, ભટકતો હતો. જ્યાં જીવ જગત અને જગદીશ વિષે અનેક માન્યતાઓ, વિચારધારાઓ, ખ્યાલો પ્રવર્તતા હોય અને તેમાંય કેટલાક તો વિરોધાભાસી, ત્યાં મારા જેવો સામાન્ય માનવી તો મુંજાઈ જ જાય ને! મને એવો તો બિલકુલ ખ્યાલ ન હતો કે બાબા તમે એક સમયે દુનિયા પર આવી શકો છો અને પ્રત્યક્ષ થઈ સન્મુખ બેસીને અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી શકો છો. મને રતીમાત્ર પણ ખ્યાલ ન હતો કે તમે આટલી સરળતાથી સહજતાથી બ્રહ્માબાબાના તનમાં પ્રવેશી, પ્રત્યક્ષ થઈ, હું જેવો છું તેજ રૂપમાં મને બાળકના રૂપમાં સ્વીકાર કરીશો. માતૃપિતાની પાલના આપશો; મારા પરમ શિક્ષક બની આત્મા, પરમાત્મા તેમજ સૃષ્ટિચક્ર વિશે તેમજ સૃષ્ટિનાટકમાં મારા જન્મો વિષે, મારા પાઈ વિષે આટલું સ્ફટિક સમાન સાફ જ્ઞાન આપશો અને મને જ્ઞાન સ્વરૂપ બનાવશો.

ભકિત કરતો હતો ત્યારે ગાયા કર્યું કે ‘અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ તું લઈ જા’, પરંતુ વર્તમાન સંગમયુગમાં આટલી સહજતાથી પ્રત્યક્ષ થઈ મારા અજ્ઞાન અંધકારને દૂર કરી મને જ્ઞાન પ્રકાશથી ઉજાગર કરશો, અસત્યથી ભરેલી દુનિયામાંથી સત્યની દુનિયા તરફ લઈ જશો, તેમજ મૃત્યુના ડરથી મને સંપૂર્ણ પણે મુક્ત કરી અમૃત સમાન મારું જીવન બનાવશો તે વાત તો મારા માન્યામાંજ નથી આવતી.

ભકિતમાં ભાવનાથી એ પણ ગાયા કર્યું કે “હે જગત્રાતા વિશ્વવિધાતા, હે સુખશાંતિ નિકેતન હૈ, પ્રેમ કે સિંધુ દીનકે બંધુ દુઃખ દરીદ્ર વિનાશન હે” “ એમ પણ ગાયું, તું મુક્તિદાતા છે, પાપ કટેશ્વર છે. પરંતુ મને ખ્યાલ ન હતો કે તમે સતગુરુના રૂપમાં મારી સન્મુખ પ્રત્યક્ષ થઈ અનેક પ્રકારના વિકારોના બંધનમાં જકડાયેલા મને તેમજ વિકર્મોના ભારથી લદાયેલા મને આટલા નિસ્વાર્થભાવથી મુક્ત કરશો અને સુખ : શાંતિ-પ્રેમ પ્રદાન કરશો.

મારા ભૂતકાળ પર દ્રષ્ટિપાત કરું છું તો ખ્યાલ આવે છે કે હું કેટલો વિષયોમાં તેમજ વિકારોમાં રચ્યોપચ્યો રહેતો હતો, દલદલમાં ગરકાવ હતો. ખાલી ચોટલીજ બાકી હતી અને મારું ભાગ્યતો જુઓ, તેજ સમયે, રાઈટ ટાઈમે આવી મારી ચોટલી પકડી મને દલદલમાંથી બહાર કાઢી નાખ્યો. મનેતો એમજ હતું કે હું તો વિષય વૈતરિણીમાં ડૂબતો જ જાઉં છું, કોઈ આશાનું કિરણ દેખાતું ન હતું. પરંતુ તમે આવી રીતે આવશો અને મારી જીવનનૈયાને વિષયસાગરમાંથી બહાર કાઢી ક્ષીરસાગરમાં લઈ જશો અને મારા ઉપર આટલો બધો ઉપકાર કરશો તેનો તો ખ્યાલ જ ન હતો.

અહલ્યાની વાર્તા પણ સાંભળી હતી કે શાપથી પથ્થર બની ચુકેલી અહલ્યા રામના પગના સ્પર્શમાત્રથી સજીવન થઈ ગઈ, પરંતુ મને જરાપણ ખ્યાલ ન હતો કે તમે પથ્થરબુધ્ધિ બની ગયેલા મને તમારા જ્ઞાનના સ્પર્શ માત્રથી પારસબુધ્ધિ બનાવી દઈ મારા પર આટલો બધો ઉપકાર કરશો !

ભકિતમાર્ગમાં મને કથાવાર્તા સાંભળવાનું પણ ગમતું હતું. તે સમયે યમરાજ અને નચિકેતા વચ્ચેનો સંવાદ પણ સાંભળ્યો હતો. આત્મજ્ઞાનથી બાળક નચિકેતા મૃત્યુના ડરથી મુક્ત થયો તે વાર્તાનો સાર હતો. પરંતુ તેમાં કયું આત્મજ્ઞાન તેનું વિશેષ કોઈ સ્પષ્ટિકરણ ન હતું. પરંતુ તમે મુજ આત્માને મારો સ્પષ્ટ પરિચય આપી, સૃષ્ટિનાટકમાંના મારા ઓલરાઉન્ડ પાર્ટથી મને અવગત કરાવી સાચા અર્થમાં મને મૃત્યુના ડરથી મુક્ત કર્યો છે, મારી શાશ્વતતાનો મને અનુભવ કરાવ્યો છે અને તે પણ કોઈ અપેક્ષા વગર.

તમે જ્ઞાનમુરલીમાં વારંવાર કહેતા આવ્યા છો કે ‘હું કોઈના પર કૃપા કરતો નથી’ પરંતુ મારા માટે આટલું બધું કરવા છતાં, હું કેવી રીતે માની શકું કે તમે કૃપા કરતા નથી? હું જ્યારે વિચારું છું કે તમે મને ક્યાંથી ક્યાં લઈ ગયા, મને કેટલા હીનમાંથી કેવો બનાવ્યો ત્યારે મને ખ્યાલ આવે છે કે તમે કૃપાસાગર નથી તો બીજું શું છે? મને જરા સમજાવશો.

મારા માટે સ્વર્ગ એક પરિકલ્પના હતી. તેની વાસ્તવિકતા વિષે ઘણીવાર શંકા પણ ઉત્પન્ન થતી, પરંતુ તમે આપેલા જ્ઞાન પ્રકાશથી સ્વર્ગ વિષેની મારી સંકલ્પના સ્પષ્ટ થઈ ગઈ. એટલું જ નહિ પણ તમે મને સ્વર્ગનો અધિકારી પણ બનાવી દીધો. રામ, કૃષ્ણ, બ્રહ્મા, વિષ્ણુ, શંકર, હનુમાન, ગણેશ જેવા દેવતાઓની તેમજ દુર્ગા, સરસ્વતી, લક્ષ્મી જેવી દેવીઓની તો હું આરાધના કરતો હતો પરંતુ મને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે આ ભારતવર્ષમાં હું પોતેજ, સતયુગના સમયે, દેવી-દેવતા હતો અને વર્તમાન સમયે તમારી કૃપાથી હું ફરીથી માટું ગુમાવેલું દેવત્વ પુનઃ પ્રાપ્ત કરી રહ્યો છું, તેનો મને અનહદ આનંદ છે.

સત્યનારાયણની કથાતો વારંવાર સાંભળી હતી. તેમાં વાર્તાનો સાર એ છે કે સત્યનારાયણનું વ્રત રાખવાથી આપણી મનોકામનાઓ તેમજ નાની નાની મહેચ્છાઓ પૂર્ણ થાય છે તેમજ વ્રત ન રાખવાથી કે વ્રત રાખવાનું ભૂલી જવાથી વ્યક્તિની કેવી દુર્દશા થાય છે. કથામાં લીલાવતી, કલાવતી, કઠિયારા જેવા પાત્રોથી આ વાત સ્પષ્ટ કરી છે. પરંતુ તે સત્યનારાયણનું વ્રત કયું? સત્યનારાયણની સાચી કથા કે વાર્તા કઈ? તેની કોઈજ સમજ મને મળી ન હતી. પરંતુ તમે તો પ્રત્યક્ષ આવીને મને સત્યનારાયણની આખી બાયોગ્રાફી બતાવી દીધી. એટલું જ નહિ પણ નજીકના ભવિષ્યમાં તમારા દ્વારા આ દુનિયા પર સ્થાપનાર સત્યનારાયણના રાજ્યમાં માટું પણ સ્થાન નક્કી કરી, મારી બધીજ મનોકામનાઓ પૂર્ણ કરી, મને ઇચ્છા માત્રમ અવિદ્યા બનાવ્યો મારા માટે આ કલ્પના બહારની વાત છે.

બાબા તમારા વિષે સાંભળ્યું તો ઘણું બધું હતું પણ મને ખ્યાલ ન હતો કે તમે આટલા બધા વિનમ્ર અને નિરહંકારી હશો અને આવી પારાવાર કૃપા કરશો.

----- 0 ---- 0 -----